

રાજકોટ મહાનગરપાલિકા

પ્રાણીસંગ્રહાલય શાખા

-::વિશેષ અહેવાલ ::-

તા. ૧૨/૧૧/૨૦૧૯

એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર(પંજાબ) તથા રાજકોટ ઝૂ વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા બાબત

- રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
- સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર વચ્ચે નીચેની વિગતે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળતા પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે.

રાજકોટ ઝૂ એ આપેલ પ્રાણીઓ		છત્તબીર ઝૂ પાસેથી મેળવેલ પ્રાણીઓ	
એશિયાઈ સિંહ	૧:૧	હમદ્રયાસ બબૂન	૧:૧
સફેદ વાઘ	૦:૧	હિમાલયન રીંછ	૦:૧
જંગલ કેટ	૧:૦	જંગલ કેટ	૧:૧
-----	---	રોઝ રીંગ પેરાકીટ	૩:૩
-----	---	એલેઝાન્ડ્રીન પેરાકીટ	૨:૨
-----	---	રીંગનેક ફિઝન્ટ	૧:૧
-----	---	જાવા સ્પેરો	૧:૧
-----	---	ઝિબ્રા ફિઝન્ટ	૦:૦:૧૦

- હમદ્રયાસ બબૂન ૧:૧ (નર-૧, માદા-૧) પૈકી હાલ માદા વાનર ૧ લાવવામાં આવેલ છે. બબૂન નર હાલ છત્તબીર ઝૂ ખાતે ઉપલબ્ધ ન હોય, ટૂંક સમયમાં તેઓ દ્વારા (છત્તબીર ઝૂ) બબૂન નર અન્ય ઝૂ પાસેથી મેળવી રાજકોટ ઝૂને સોંપવામાં આવશે.
- હાલ આ તમામ પ્રાણી-પક્ષીઓને ત્રણ અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે. ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવશે.
- ઉક્ત પ્રાણી-પક્ષીઓ આવતા હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૫ પ્રજાતીનાં કુલ-૪૩૦ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે.
- હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર હમદ્રયાસ બબૂન રાખવામાં આવેલ નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનેલ છે.
- ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ પડતા ઝૂની બંને બાજુનાં બંને

તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઇ જતા તથા ઝૂનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ ખુબ જ પ્રભાવીત થાય છે.

- દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન રાજકોટ ઝૂ મુલાકાતીઓ માટે ફરવા માટેનું હોટ ફેવરીટ સ્થળ બની ચુક્યું છે. દિવાળીના તહેવારોથી આજદિન સુધી (તા.૨૭/૧૦/૨૦૧૯ થી તા.૧૧/૧૧/૨૦૧૯ સુધી) ઝૂ ખાતે ૮૧,૦૦૦ થી પણ વધારે મુલાકાતીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨૦.૦૦ લાખથી પણ વધારે આવક થયેલ છે.

ઝૂ સુપ્રિટેન્ડન્ટ
રાજકોટ મહાનગરપાલિકા



